

August 13, 2024

BSE Limited National Stock Exchange of India Limited

Phiroze Jeejeebhoy Towers, Exchange Plaza,
Dalal Street, Fort, Bandra Kurla Complex,
Mumbai - 400 001 Bandra (East),

Bandra (East), Mumbai - 400 051

Company Code No.: 543268 Company Symbol: DRCSYSTEMS

Dear Sir / Madam,

Sub: Newspaper Advertisement - 12th Annual General Meeting through Video Conferencing /Other Audio- Visual Means ("VC/OAVM") Facility

Pursuant to Regulation 30 & 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper advertisements published in the Financial Express (English -National Daily All Editions) and Financial Express (Gujarati Edition) newspapers on August 13, 2024, intimating that the 12th Annual General Meeting of the Company will be held on Tuesday, September 17, 2024 at 11.00 a.m. IST through VC/OAVM facility and other information in compliance with the applicable laws and circulars issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India

We request you to kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

For DRC Systems India Limited

Jainam Shah Company Secretary

Encl.: As above

Parsynaths

committed to build a better world

PARSVNATH LANDMARK DEVELOPERS PRIVATE LIMITED

Office: Parsvnath Tower, Near Shahdara Metro Station, Shahdara, Delhi - 110 032

U4S201012003PTC122489, Tel.: 011-43050100, 43010500; Fax: 011-43050473

Email: secretaria@parsvnath.com; website: www.parsvnath.com/eldol

SL.	Particulars	Quarter ended 30-06-2024	Quarter ended 30-06-2023	Year ended 31-03-2024	
-		Unaudited	Unaudited	Audited	
1	Total Income from Operations	1,104.66	655.98	5,590.53	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(44.86)	(2,530.73)	(6,471.15)	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(44.86)	(2,530.73)	(6,471.15)	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(221.89)	(3,425.25)	(7,365.67)	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(221.89)	(3,425.25)	(7,366.73	
6	Paid up Equity Share Capital	328.21	328.21	328.21	
.7	Reserves (excluding Revaluation Reserve)	(32,313.60)	(28,149.74)	(32,091.70)	
8	Net worth	(31,985.39)	(27,821.53)	(31,763.49)	
9	Paid up Debt Capital / Outstanding Debt	-	-	-	
10	Debt Equity Ratio	(0.50)	(0.61)	(0.54)	
11	Earnings Per Share (of Rs.10.i-each) (for continuing and discontinued operations) -				
	1. Basic:	(6.76)	(104.36)	(224.46)	
	2. Diluted:	N.A.	NA.	N.A.	
12	Debenture Redemption Reserve	5,000.00	5,000.00	5,000.00	
13	Capital Redemption Reserve		-		
14	Debt Service Coverage Ratio	(0.03)	(1.94)	(1.13)	
	(Since earnings before interest and tax is Negative)				
15	Interest Service Coverage Ratio		(1.94)	(1.13)	
	(Since earnings before interest and tax is Negative)				

- Nortes:

 3 The above is an extract of the detailed format of financial results fled with the Stock Exchange under Regulation 52 of the SSBI Lituding Obligations and Disclosure Requirements) Regulations, 2015 (*Listing Regulations*). The full format of the financial results are available on the swedulest of SPES Lide the beneficial command for Compray (www.pasneath.com/pidgs).

 b) For the other line items referred in Regulations 52 (4) of the Listing Regulations, the perficient disclosures have been made to SSE Ltd. and can be accessed on the URL www.belindia.com.

 of the above financial results have been engined to the state of the st

For and on behalf of the Board Parsvnath Landmark Developers Pvt Ltd Sd/-Surya Mani Pan

Place : Delhi Dated: August 10, 2024

Director DIN: 08250346

Parsynaths

PAISUMAN TOTATE DEVELOPERS PRIVATE LIMITED

Regd. Office: Paramain Trees, PAISUMAN TOTATE DEVELOPERS PRIVATE LIMITED

Regd. Office: Paramain Trees, PAISUMAN TOTATE DEVELOPERS PRIVATE LIMITED

Regd. Office: Paramain Trees, PAISUMAN TOTATE DEVELOPERS PRIVATE LIMITED

E-mail: secretarial@paramain.com paisuman totate private pri

SL. No.	Particulars	Quarter ended 30-06-2024	Quarter ended 30-06-2023	Year ended 31-03-2024
		Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	1,968.24	1519.41	7,309.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4,916.18)	(4721.11)	(18,568.77
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(4,916.18)	(4721.11)	(18,568.77
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4,916.18)	(4721.11)	(18,578.12
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(4,916.18)	(4721.11)	(18,578.15
6	Paid up Equity Share Capital	500.00	500.00	500.00
7	Reserves (excluding Revaluation Reserve)	(1,06,321.50)	(87548.30)	(1,01,405.35)
8	Net worth	(1,05,821.50)	(87048.30)	(1,00,905.35
9	Paid up Debt Capital / Outstanding Debt	1,49,432.52	152949.91	1,45,921.76
10	Debt Equity Ratio	(1.23)	(1.51)	(1.30
11	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic:	(98.32)	(94.42)	(94.42
	2. Diluted:	N/A	N/A	No.
12	Capital Redemption Reserve		-	
13	Debenture Redemption Reserve		-	
14	Debt Service Coverage Ratio	0.21	0.24	0.26
15	Interest Service Coverage Ratio	0.21	0.24	0.26

- Notes:
 a) The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI
 (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015' (Listing Regulations). The full format of the financial results
 are available on the website of 851 kt of lower benefinds com) and the Company (towas partmath.com/meesters/lult/subdistinycompanies/legical/dato-us-iv-2-1).
 b) For the other fine thems referred in Regulation 52 (4) of the Listing Regulations, the pertinent disclosures have been made to 851
 ktd. and can be accessed on the URL was benified acom.
 c) The above financial results have been approved by the Board of Directors in the meeting held on 10 August 2024.
 c) The Company has not received any compilant from the investor during the quarter ended 30 June, 2024 and there was no
 consoliat accessing at the belevinion of the quarter.

Surya Mani Pandey Director DIN: 08250346

Place : Delhi Dated: August 10, 2024 π DRC

Place: Gandhinagar Date : August 12, 2024

DRC SYSTEMS INDIA LIMITED

[CIN: L72900GJ2012PLC070106]

Registered Office: 24° Floor, GIFT Two Building, Block No. 56, Road-5C, Zone-5, GIFT CITY,
Gandhinagar - 823 55, Gujarat, India

Tel: +91 79 67772222 Email: ir@drcsystems.com Website: www.drcsystems.com

NOTICE OF 12° ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC)/OTHER AUDIO-VISUAL MEANS (OAVM)

NOTICE is hereby given that the 12° Annual General Meeting ("AGM") of the Members of DRC Systems India Limited ("the Company") will be held on Tuesday, September 17, 2024 at 11:00 a.m. IST through Video Conferencing (VCJ) Other Audio Visual Means (OAVM) to transact the businesses as set out in the Notice of the AGM in compliance with General Circular Nos. 14/2020 dated April 32, 2020, 202020 dated May 5, 2020, 20202 dated May 5, 2020, 20202 dated May 5, 2020, 20202 dated May 65, 2022, 10/2022 dated December 28, 2022, 09/2023 dated September 25, 2023 and relevant circular issued by the Ministry of Corporate Affairs (MCA) collectively referred to as MCA Circulars) and Circular Nos. SEBIHO (CEDICAMD) CIRCULAR (2020) 99 dated May 12, 2020, Circular SEDIMENTER (2020) 99 dated May 12, 2020,

tots, 2022, 10/2022 and relo December 28, 2022, 10/2023 dated september 25, 2023 and relevant reload in the color by the Ministry of Corporate Affairs (MCA) (collectively referred to as MCA Circulars) and Circular Nos. SEBH/HO/CFD/CMDI/CIR/P/2020/79 dated May 12, 2023. Circular no. SEBH/HO/CFD/P0D-2P/CIR/2023/167 dated double January 05, 2023, and Circular No. SEBH/HO/CFD/P0D-2P/CIR/2023/167 dated October 07, 2023 issued by the Securities and Exchange Board of a Exchange Board of India (hereinfaire referred to as Circulars) and other applicable laws and circular Standard of India (hereinfaire referred to as Circulars) and other applicable laws and circular Standard of India (hereinfaire referred to as Circulars) and other applicable laws and circular standard of India (hereinfaire referred to as Circulars) and adverses are registered with the Company of the Company and an activation of the Company and adverses are registered with the Company at 166/decsystems.com. Members may note that Notice of AGM and Annual Report 2023-24 will also be available on the website of the Company at waw dressystems.com, websites of the Stock Exchanges i.e. the ISE Limited and the National Stock Exchange of India Limited at www.besindia.com and www.ness-india.com respectively and on the website of India India at www.besind.com and www.ness-india.com respectively and on the website of India India at www.besind.com and www.ness-india.com respectively and on the websit of the Konghany at the AGM. Detail at www.besind.com and www.ness-india.com and www.ness-india.com of the Company at waw.dress-tems.com, websites of the Stock Exchanges i.e. the ISE Limited and the National Stock Exchanges of India Limited at www.besind.com and www.ness-india.com and www.ness-india.

For, DRC Systems India Limited Sdi-Jainam Shah Company Secretary

14 FINANCIAL EXPRESS

AETHER INDUSTRIES LIMITED

Registered and Corporate Office: Plot No. 8203, GIDC Sachin, Surar. 394230, Gujarat, India Website: vewsaether.co. In. Bmail: compliance@aether.oci.ic. L241006J.2013PLC073434

CHETTER Sadmin, Sorati- 394-29, Gugani, India distinction of the Compilarios (gardine co. In. Iradia Compilarios (gardine) compilarios (gardin

103 of the Act.

Eventing: Company is providing the facility to the Members to cast their voles on the business set from in the ACM Motice through remote evoting. Detailed procedure for remote evotings undised in the ACM Motice. The builty for evoting valid so be provided at the ACM and Members attending the ACM, who have not casted their voles by remote evoting, will be able to void at the ACM and Members whose e-mail IDs are not registered, may refer the procedure outlined in the ACM Motice for promising Iser® and application of an all IDs re-voling. As there is no recommendation of the Board on dividend, related details are not mentioned herem.

mentionehnerin.

Members who have not registered / updated their e-mail address and / or bank account details, are requested to register / update the same in the records of the Company / Depository, as the camp update in the lower programment.

Members holding shares in Demat Form | Through their respective Depository Participant.

For Aether Industries Limited.

Date: August 12, 2024 Place: Surat

RateGain®

RATEGAIN TRAVEL TECHNOLOGIES LIMITED

CIN: L72900DL2012PLC244966 Fegd. office :- M-140, GREATER KAILASH PART-II, NEW DELHI - 110048, INDI.

Extract of Statement of Unaudited Consolidated Fina for the quarter ended June 30, 2024

Pariculars		June 30, 2024	March 31, 2024	June 30, 2023	March 31, 2024
		(Un-audited)	(refer note 3)	(Un-audited)	Audited
1.	Total Income	2782.82	2768.57	2204.63	9985.86
2.	Income from operations	2600.13	2558.10	2144.78	9570.31
3.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items.)	582.38	654.51	321.14	1888.72
4.	Net Profit for the period before tax (after Exceptional ardior Extraordinary items)	582.38	654.51	321.14	1888.72
5,	Net Profit for the period/year tax (after Exceptional and/or Extraordinary items)	453.75	500.24	249.09	1453.93
ò.	Total comprehensive income for the period (comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	442.02	484.00	206.27	1505.53
ī.	Equity Share Capital	117.78	117.78	108.32	117.78
3,	Other equity				14386.93
9.	Basic and diluted earnings per share (Face Value of INR 1 each) Basic EPS	3.85 (Not.) annualised	4.25 (Not annualised)	2.30 (Not annualised)	13.01
ľ	Diluted EPS	3.81 (Not annualised)	4.20 (Not annualised)	2.28 (Not annualised)	12.84

- otes: The above consolidated financial results have been prepared in accordance with the Indian Accounting Standards (referred to as I'm & AS) as prescribe under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rivals. 1016, as amended from time to time. The above consolidated in the Quarter ended June 30, 2024 were reviewed and recommended by the Audit Committee and subsequely approved by the Sound of Directors at its meeting held on August 12, 2024. The Statutory Auditoris have certified out intended review of the financial results of the Company for the quarter ended June 30, 2024. The Statutory Auditoris have certified out intended review of the financial results of the Company for the quarter ended June 30, 2024. The Statutory Auditoris have pages to-dealing pages with the Minder Statutory Auditoris of the Company for the quarter ended financial results field by the company with the pages to the designed with the Minder Quarter of the financial great control of the Company of the pages of the Statutory Auditoris and Pages and the Results of the Company with the statutory and the regulation 3 of the Statutory Auditoris and Thindows Pages (2015) and the Auditorial Committee of the above financial results statutory and the reviewed statutory and the regulation 3 of the Statutory Auditorial Pages (2015) and the Auditorial Pages (2015)

June 30, 2024	March 31, 2024	June 30, 2023	March 31, 2024	
(Un-audited)	(refer note 3)	(Un-audited)	Audited	
655.37	677.30	448.95	2212.28	
494.49	492.71	384.15	1733.92	
188.94	243.49	69.41	594.15	
143.04	179.34	51.69	438.69	
	30, 2024 (Un-audited) 655.37 494.49 188.94	June March 30, 2024 31, 2024 (Un-audited) (refer note 3) 655.37 677.30 494.49 492.71 188.94 243.49	June March June 30, 2024 31, 2024 39, 2023 (Un-sudited) (Fefr note 3) (Un-sudited) (Fefr note 3) (48, 95, 494, 49) 492,71 384,15 188,94 243,49 169,41	

For and on behalf of the Board of Director RATEGAIN TRAVEL TECHNOLOGIES LIMITE

*	ORCHID III	LIMITED	Ladh, Jhagad	GADH h. Aage Badh	Chill	E S O R T S	1	e kň	mal
		AMAT HO e: 70-C, Nehru Road,							
		e: 70-C, Nenru Road, 11986PLC039307, \					000		
E	EXTRACT OF UNAUDITED STAT	TEMENT OF	STANDA	LONE AN	D CONS	OLIDATE		ICIAL RE	SULTS
	FC	R THE QUA	RTER EN	NDED 30T	H JUNE	2024			<i>a</i>
ń		-1	Star	ndanne			Cons	olidated	(₹ in Lak
Sr. No.		Quarter Ended 30.06.2024 (Unaudited)	Quarter Ended 31.03.2024 (Unaudited)	Quarter Ended 30.06.2023 Unaudited)	Year Ended 31.03.2024 (Audited)	Quarter Ended 30.06.2024 (Unaudited)	Quarter Ended 31.03.2024 (Unaudited)	Quarter Ended 30.06.2023 (Unaudited)	Year Ende 31.03.202 (Audited
	Total income from Operations : Net Profit / (Loss) for the period before tax (before exceptional in Net Profit / (Loss) for the period before tax (after exceptional it Net Profit / (Loss) for the period after tax (after exceptional itser Total Comprehensive Income for the period Comprising profit.)	5,031.08 (terns) 82.36 (ems) 82.36 (ns) 40.55	6,195.72 675.44 675.44 123.01	5,153.51 583.37 283.37 136.93	22,291,39 2,421,18 5,373,62 4,523,95	7,375.62 (77.46) 196.64 106.73	8,451.34 822.26 822.26 212.78	6,961.67 557.75 257.75 111.21	30,434.52 2,440.35 5,392.80 4,484.72
8	for the period (after tax) and Other Comprehensive Income (af Paid-us Equity Share Capital (Face value of Equity Share Rs.)	ter tax) 43.30	123.65	148.80	4,542.37	107.56	214.95	125.14	4,513.3
7 8	each) (including forfeited shares) Other equity (Reserves excluding revaluation reserves) Earnings per share (EPS) (Face value of Rs. 10/- each)	2.712.06	2,649.50	2,524.14	2,649.50 27,120.44	2,712.06	2,649.50	2,524.14	2,649.5 17,913.7
	Basic (In Rupees) Diluted (In Rupees)	0.15 0.14	0.48 0.43	0.56 0.50	17.67 15.94	0.39 0.37	0.82 0.74	0.45 0.41	17.5 15.8
1)	tes: The above standalone and consolidated results have been pre- under section 133 of the Companies Act, 2013. The above is an extract of the detailed format of Unaudited Fina Requirements; Regulations, 2015. The full format of the abo- www.hit.com.	noial Results for the quan	ter ended 30th Ju available on the	ne, 1024, filed with Stick Exchange	the Stock Exchan websites- www.t	noes under Requisi	ion 33 of the SEE	II / Listing Obligation	s and Disclos

income Profit on Sale / Discard of Property Plant and Equipment 3,252.44 3,252.44 Sub-total (A) 3,252.44 3,252.44 300.00 2.952.44 Sub-total (B Total (A-B) 273.10

Camlin CAMLIN FINE SCIENCES LIMITED

CIN: L74100MH1993PLC075361

Registered Office: Floor 2 to 5, Building "in G. 3. Point", C.S.T. Road, Kalina, Santacruz (East), Mumbai – 400 098, India Tel: 91-22-67001000; Fax: 91-22-283740; Email: secretaria@camilinfs.com; Website: www.camilinfs.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED JUNE 30, 2024

No.	PARTICULARS	STANDALONE				CONSOLIDATED			
	1 (2.000 mod 20.000 0000000000000000000000000000000	QUARTER ENDED		YEAR ENDED	QUARTER ENDED			YEAR ENDED	
		30.06.2024	31.03.2024	30.06.2023	31.03.2024	30.06.2024	31.03.2024	30.06.2023	31.03.2024
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	18,191.22	22,032.97	16,111.16	77,326.21	39,585.33	40,169.38	41,960.26	1,61,306.20
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	(1,759.69)	(4,675.36)	726.22	(5,770.40)	(2,348.06)	(4,370.17)	1,607.72	(4,943.95)
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional items)	(1,759.69)	(4,868.20)	'26.22	(5,963.24)	(2,348.06)	(9,350.57)	1,607.72	(9,924.35)
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional items)	(1,368.01)	(4,407.30)	\$78.04	(5,138.92)	(3,465.02)	(8,178.51)	1,201.67	(10,487.51)
5	Net Profit / Loss for the period after tax and non-controlling interests (after exceptional items)					(3,395.41)	(7,713.94)	1,555.46	(9,275.34)
6	Total Comprehensive Income for the period	(1,312.71)	(4,429.79)	'09.01	(5,143.38)	(4,059.89)	(8,270.81)	1,699.11	(8,691.10)
7	Equity Share Capital	1,674.95	1,674.65	1,\$73.52	1.674.65	1,674,95	1,674,65	1,673,52	1,674,65
8	Other Equity	10			69.896.76	9-1111-	2		84.800.43
9	Earnings per share (of ₹ 1/- each) (not annualised)								
	- Basic ₹	(0.82)	(2.65)	0.36	(3.09)	(2.03)	(4.64)	0.96	(5.58)
	- Diluted ₹	(0.81)	(2.61)	0.35	(3.05)	(2.01)	(4.58)	0.94	(5.50)

The above information is an extract of the detailed format of unaudited results by the quarter ended June 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, The full format of the unaudited results for the quarter June The above information is an extract or executive to an executive to a support of the control of

FOR CAMLIN FINE SCIENCES LIMITED

Dr. Vithal V. Kamar Executive Chairman and Managing Director (DIN: 00195341)

Ashish S. Dandeka Chairman & Managing Director DIN: 01077379

financialexp.epapr.in

Place : Mumbai

Date : August 12, 2024





કમ નં.	દેવાદાર/સલ-દેવાદાર/જામીનદારનું નામ અને લોન એકાઉન્ટ નંબર	માંગણા નોટીસની તારીખ અને બાકી રકમ	રશાવર મિલકતની વિગત	<u>કબજાની તારીખ</u> કબજાનો પ્રકાર
•	૧, ક્રીમાંની ભારતીઓન હરિસ્પાંદ્ર પાસવાલા (દેવાદાર/ગેરિનેદા? ૨, ક્રીમાંની કિલ્લા દાવલતુમાર પાસવાલ (સલ-દેવાદાર/ગીરવેદાર), ૩, ક્રી દાવલતુમાર હરિસાર્ઘંદ્ર, પાસવાલા (ભાગીનદાર) (લોન એકાઉન્ટ નં. પાસ્ટલપાં (ભાગીનદાર)	શ્ર.૧૧.૨૦૧૧ વા. ૧૨૧૫૧૫૧.૩૦/– (વૃષિના અઠનાવીસ લાખ પરલીસ હૃત્યર સારસો સોખન અને ત્રીસ પૈસા પુષ્ટ)	થોમ નં. એક્ટ્રોએન-પર અને એક્ટ્રોએન-પર, તુવા કેરેટ્રાઇટ કંપાઈન રાત્ર કરે મી. િલ્લ ક્યાં અને ખંડત ક્ષોત્રી. લિલ્લો કર્યાં અને બડત ક્ષોત્રી. લિલ્લો કર્યાં અને ખડત ક્ષોત્રી. લિલ્લો કર્યાં કર્યા કરિયા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કરિયા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કર્યા કરિયા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કરિયા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કરમા કર્યા કરમા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કરમા કર્યા કરમા કરમા કરમા કરમા કર્યા કરમ	8505.20.05 elifin feroe
ę	વ. કિલ્લા દાવલકુમાર પાસવાલા (દેવાદાર/ગીરવેદાર) ર. ભારતીબેન દ્વરિશચંદ્ર પાસવાલા (સહ-દેવાદાર/ગીરવેદાર) 3. શ્રી દાવલકુમાર એસ પાસવાલા (ભર્મીનદાર) (લોન એકાઉન્ટ નં. પત્રરે૭૧૧૦૦૦૦૦૪)	૦૯.૦૩.૨૦૨૧ રા. ૨૩૮૬૯૩૮.૧૦/- (રૂપિસા ત્રેવીસ લાખ છસાંગી હુજાર નવસો આડત્રીસ અને દસ પૈસા પુસ)	થોય નં. એફએફ)પુંપર અને એફએફ) પર, કર્ય માળ, શ્રીશું (લર્લીડ), એફએફ પાત્રાઓ લાજુનો, આતંદ મહત્વ હોર્ડ, રેવન્યું સર્વે નં. દુક્ત, ટાઉન પ્રાતિઓ ત્યુરેમ નં. ૧૨ (અડાપણ), સુધાનતા પાત્રો નં. કર્યું હોઇ ત્યાં અને અંદ (ચેંદી) એ, મોર્ચ અડાપણ, સુધાનતા પાત્રે નં. અદ્દાં હોઇ ત્યાં અને અંદ (ચેંદી) એ, મોર્ચ અડાપણ, સુરત- કલ્પાલ્ટન, ગુપરાતા તો સફળ લુલ એદિયા રહ્યાં હોદ્દ, કર્યાં હોદ્દે સાથે અદિયા, શ્રી કિલ્મા લાલવામાં આવેલાં અને બ્રીમતી ભારતીએન લાદિઓ સ્વાર્ટ પાસ્ત્રાલા અને બ્રીમતી ભારતીએન લાદિઓ સ્વાર્ટ પાસ્ત્રાલા આદ્રીનીએ લિલ્સ સ્વાર્થ પ્રાત્સાલાની આદ્રિલીએની ભારતીએન લાદીઓની ભારતી સ્વાર્થ હોદ્યાં, સ્વાર્થ	8505.30.09 विशिष्ट विशिष्ट
3	શ્રી રામુકે લરૂમણ ચૌદારી (દેલાદાર/ગીરવેદાર), ર. શ્રીમતી સુનિતા દેવી રામુકે ચૌદારી (સહ–દેલાદાર/ગીરવેદાર) (લોન એકાઉન્ટ નં. પ૧૨૩૦૧૧૦૦૦૦૦૨૪)	્યત્વર.૨૦૨૨ 31. ૪૮૧૦૨૦.૬૦/- (રૂપિયા સાર લાખ એક્સાંસી હજાર સાતાઓ સત્યાવીસ અને સાહીઠ પૈસા પુરા)	કરોટ નં. ૮૦, લ્લોક નં. બી, એરકામાળુ—ર, ટીપી કોમ નં. ર (એફ.પી. નં. ૨૫, યુના સાલી હેઠગોલ નગ સમો, વેયુ, લીઆપથી રોડ, સુત્ત-૩૯૫૦૦, ગુજરાત. ફાલેગ્દુલા ૧૨,૮૦૦ લો.મી. બિલ્દ અપ એરિસા તેમ્ખ મહિલી કીમતી ફોનિલાદેવી પ્રમું લીલાઈ અને 81 મુશ્કે લક્ષ્મા પાલેશની મિલકનાન તમામ ભાગ અને ફિસ્સા. ચતું સીમા ઉત્તર: ફલેટ નં. ૮૦૨, પૂર્વ : ગામ. મીટરનો અંદર નો દરે, કોમો સી મેળ બિલ્દી મળે, દક્ષિણ : પોર નો ૮૦૫, પશ્ચિમ : કોમા સી મેળ અને ફલેટ નં. ૮૦૨, પૂર્વ	૧૦.૦૮.૨૦૨૪ ભીતિક કબજો

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ.

(અગાઉ ઇવિસ્ટાસ ફાંઇનાન્સ લિવિટેક તરીક જાણાતા) કેપોરેક ઓફિસ : નંધર 769 સંબેલ પ્રાપ્તા ચોર્યા ગામ, કેન્ટ? અન્ય સલાઇ, ચેનાઇ - 600002. સમા ઓફિસ: કાર્યક્રમાં સ્થાપ અધિક્રી એફ્ટેક્ટ, સનાઇડ મોલ પાસ, મનાની સર્કલ, જજીસ નવારાદ

હામાં કહ્યું કરે છે. જે જો લાં, આવા હામ, અલાક લાં પણ લાં થયા લાં કર્યા લાં કર્યા લાં કર્યા લાં કર્યા લાં કર્યા લાં કર્યા લાં કરાય કરવા કર્યા હામ કર્યા હામ કર્યા લાં કર્યા હામ કરા હામ કર્યા હામ કર

15	દેપાદાર /સાદ-અરજદાર /સાદ-દેપાદાર / જામાંગદાર / ાનરપદાર નુ વ્યાગ દારપામાં આપશ								
9 +1	અરજદાર(ઓ) / જામીનદાર (ઓ) નું નામ	સિક્યોર્ડ એસેટનું વર્ણન (સ્થાવર મિલકત)	ડિમાન્ડ નોટિસ તારીખ અને અમાઉન્ટ	કબજાની તારીખ					
	લોમેના પુરિયા ખાતા ન 700005294411 / EMFANDAN0036919 & 700005299020 / દા શ્રી માર્ચક સંખ્યાદકારોન સખીરનું સન જ શ્રી સમીરનું કર્મના પૈત્ર દ. શ્રી માર્ચ કાર્યાદિલહુર્સન સખિતુરોન જ શ્રી સમીરનું સન્ પત્ર ૩. શ્રીખત્રી માર્ચક સ્થાદિલહુર્સન પત્ર ૩. શ્રીખત્રી માર્ચક સ્થાદિલહુર્સન પત્ર ૩. શ્રીખત્રી માર્ચક સ્થાદિલહુર્સન પત્ર	પાંત્રેક સંભળકાનું સ્વિપાનું મહિલાનું માર્વાલાનું સંસ્થાનું માર્વાલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાનું માર્વલાલાનું માર્વલાલા	રૂ. ૮,૬૭,૧૨૯/- (રૂપિયા અલાખ સડસઠ હજાર એકસો ઓગણત્રીસ પુરા) ૧૩/૦૫/૨૦૨૪ ના રોજ બાકી	0C 0C 5052					
:	લોનો સુવિધા ખાતા નં. 700005741869 / EMFAMDED0040275 & 700005744966 / / ELPAMDED0040276 દ મો શ્રી તાનાસિંક જે શ્રી લગેદ સિંહ તા પુત્ર દ, શ્રીપતી રાજપુરોહિત નર્ધદાએન સીતાનસિંહ ઉપનાપ સીતાનસિંહ જે શ્રી સીતાનસિંહ ઉપનાપ સીતાનસિંહ જે શ્રી સીતાનસિંહ તી પત્ની	કેમતાર્ગિક, રાજપુર્વિતિ જોદાએક લેમતાર્ગિક ની પ્રાથિતિથી કરોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યોદાં મિલાન કર્યાં હતા કર્યાં હતા કર્યાં કર્યા કર્યાં કર્યા કર્યાં કર્યાં કર્યાં કર્યાં કર્યાં કર્યાં કર્યા કર્યાં કર્યા કર્યાં કર્યાં કર્યા કર્યાં કર્યા કર	(રૂપવા અંદાર લાખ સુડતાલીસ હજાર એકસો સત્તાણું અને એકાવન પૈસા પુરા) ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ બાકી	02/02/2088					

DRC ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ

વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયો – વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા ચોજાનાર કંપનીની ૧૨મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

"એડાએમ") મંગળવાર, ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વિડિયો કોન્કરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયો વિગ્રસુઅલ મારચમો (ઓએવીએમ) દુારા એશુએમળી બોટીસમાં જ્લાવેલ કાર્યો પાર પાડવા માટે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વાર કરાશેલ ૧૦૧૮લ સરક્સલર લે. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે 20૨૦, ૨/૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨, ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર ,૨૦૨૩ અને સબંધિત પરિપત્રો (એક સાથે એમસીએ પરિપળો તરીકે દર્શાવેલ છે) અને સિક્યોરીટીઝ અને એક્સરોન્જ બોર્ડ ઓક ઇન્ડિયા દારા જારી કરાયેલ પરિપળ (અત લાલ બનાલાળ પારત્યા લાવ દાયાલા છ) તેળા લાંગ્લાલાટા છેલા છેલાં છેલાં છેલા છેલા છેલા છેલા છેલા ક્લાવ પાર્વાન એ. ESBIHOLOFENDICIRIP20202079 લાંશીખ ૧૨ મે, ૨૦૨૦, પરિપળ તો , SEBIHOGENPOD-2PPCIR202346 લાંશીખ ૦૫ ૧૧૧ન્યુઆરી, ૨૦૨૩ અને સરક્યુલર નં. SEBIHOLOFENPOE-2PPCIR20234167 લાંશીખ ૦૦ ઓક્ટોબર, ૨૦૨૩ (અહી પછી પરિપળો તરીકે દક્ષવિલ છે) અને અન્ય તમાગ લાગુ કાયદાઓ અને કોર્પોસ્ટર અફેસ મંત્રાલસ (એમસીએ) અને . સિક્સોરીટીઝ અને એક્સરોન્જબોર્ડ ઓફ ઈલ્ડિસા(સેબી) દ્વારા જારી કરાલેલ પરિપયોની જોગવાઇઓના અનુપાલન હેઠળ યોજાશે. ઉપરોક્ત પરિપયોના અનુસંધાનમાં, એગ્રુએમની નોટીસ તેમજ વાર્ષિક અહેવાલ ૨૦૨૩–૨૪, જે સભ્યોના છાંઇલ એડ્સ કંપની(ઉપોગ્રુટરીઓ પાસે રગ્રસ્ટર્ડ છે તેમને ફક્ત છહેક્ટ્રીબિક માધ્યમથી મોકલવામાં આવશે સિવાય કે કોઇ સભ્યે હંપનીને ir@drcsystems.com ઉપર લેખીતમાં તેની ફીઝીકલ નકલ માટે અરજી કરી હોય. સભ્યોએ નોંધ લેવી કે એજીએમની નોટીસ અન ા હાલિક એતીવાલ ૧૯૩૨-૧૯ કંપાનીની વેબસાયટ <u>આપ તંદાવકામાં દાતા અને સ્ટેરા કે બેક્સનેન્નો સ્ટેરા કે લીકોમાં વધિનેટ કન્નેન્ નોલાના કરેક એતાવાલ ૧૯૩૨-૧૯ કંપાનીની વેબસાયટ <u>આપ તંદાવકામાં દાતા</u> અને સ્ટેરા કે બેક્સનેન્નો સ્ટેટા કે લીકોમાં વધિનેટ કને નોલાના દરેક એતાવાનેન્ન અને કર્ષ બેક્સા વીમીટેકની વેબસાયટ અનુક <u>એ આપ પ્રકાર્શનો દાતા દાતા અને અપળ પ્રકાર કર્યાનો</u> કિંદ કન્નાટામાં ઇન્ડિયા પાતાવેટ તિમીટેક (વિ હનાટાપ) ની વેબસાયદ <u>મોતા માત્ર કર્યાનો હાલાવેટ</u> સ્ટામ વેલા કરાવાનો આવશે. સગતો ફુક તો સીટી / ઓએવીએમ દ્વારા એપુઝોમમાં હાલ્સી આપી શકે છે અને ભાગ લાળ શકે છે. તીરી / ઓએવીએમ દ્વારા એપુઝોમમાં હાલ્સી આપી શકે છે અને ભાગ લાળ શકે છે. તીરી / ઓએવીએમ દ્વારા એપુઝોમમાં હાલ્સી આપી શકે છે અને ભાગ લાળ શકે છે. તીરી / ઓએવીએમ દ્વારા</u> ભાગ લેનાટ સભ્યોની કંપની કારદા, રુજા રની કલમ ૧૦૩ મુજબ એપુઝએમ માટે કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. વીસી/ઝોએવીએમ મારફત એપુઝએમમાં હાજર રહેવાની સુચનાઓ એપુઝએમની નોટીસમાં આપવામાં આવતો કંપની તેના તમામ સભ્યોને એપુઝએમની નોટીસમાં જણાવેલ તમામ હરાવો પર તેમના મત આપવા માટે સભા પહેલા રીમોટ ઇ- વોટીંગ

તેમજ સભા દરમિયાન ઈ-વોટીંગની સવલત પુરી પાડશે. રીમોટ ઈ-વોટીંગ/ઈ-વોટીંગની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમ

. પનીની એજીએમની નોટીસ રવાનગી માટે કટ-ઓફ તારીખના રોજ શેરહોલ્ડીંગ ધરાવતા શેરહોલ્ડરોને નિયત સમયે તેમ

સહી/-

હિંડનબર્ગના આરોપો પાયાવિહાણા, ગેરમાર્ગે દોરનારા : આરઈઆઈટી

મીત્રીઆર્ટ નવી દિલ્હી, તા.૧૨

ભારતીય આરઈઆઈટી એસોસિએશને સોમવારે જણાવ્યું હતું કે, અમેરિકન સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા

થ્રી રાકેશકુમાર પ્રદ્યુમન મહેતા, શ્રીમતી કરૂણાબે પ્રદ્યુમનભાઈ મહેતા

સુરેશકુમાર લુહાર, એમએસ માઇક્રો મેટલ

ભ્રામક છે. વાસ્તવમાં એસોસિએશનને કઠોર નિયમનકારી વાતાવરણ બનાવવા માટે સેબી અને તેના

ટાટા કેપિટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ

રથાવર મિલકતના વેચાણ માટે નોટીર

શ. ૧૨૩૨૬.૩/- લોન એકાઉન્ટ નં. ૧૦૧૧૩૦૧૫ હેઠળ તમારા દ્વારા બાકી અને નુકવલા પાત્ર અને શે. પપણ ૧૪/- લોન એકાઉન્ટ નં. 1885001 હેઠળ તમારા દ્વારા બાકી અને નુકલલા પાત્ર શે. ૨૧૧૩-૭/- નોન એકાઉન્ટ નાં. TOMIO25900/100/104667 હેઠળ તમારા દ્વારા બાકી અને નુકલલાપાત્ર ફુલ શ. ૮૯૬૨૭/- (લેઠીમાં આઠ લાખ કજા ફુલનર બારો સુંમોતેર પુરા)

२० करने समय भागन पुरुष्क ने पार प्रतिकृति का स्वार्थित स्वार्थित कर स्वार्थित स्वार्यित स्वार्य स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्य स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्य स्वार्थित स्वार्य स्वार्थित स्वार्थित स्वार्य स्वार्य स्वार्थित स्वार्थित स्वार्य स्वार्थित स्वार्य स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्थित स्वार्य स्वार्थित स्वार्य स्वार

98-90-2023

અને સુકલવા પાત્ર રૂા. ૯૨૦૦૦૫/– (રૂપિસા નવ લાખ વીસ હજાર પાંચ પુરા)

મીટર શેક, પશ્ચિમ-પહેર ને 33 અને 34, ઉદાર જ્યારે વર્ષ નિવાસ પાત્રના સ્થાર કે, ભાગ અને ફિટ્સા સહુરોમાં મુક્ત કે, પશ્ચિમ-પહેર મનાનો લાકિનારા હો તે એમાં લીધે સુખર લખ્ય હેના રહ્યાં, લેમારા અપારે લે પ્રાપ્ત ને સામગે તે સામ કે માને લિક્સા સહુરોમાં મુક્ત કે લાભુમાં ખાટે મનાનો લાકિનારા હો તે એમાં લીધે સુખર કરવા સ્થાપના છું તે પ્રાપ્ત લે ગ્રેપન- ને વાદાએ તે સામી કા માને લોધી સામ તે કોમ તે માને લાગ કરવા સ્થાપના છે. તે માને ભાગ તે માને લીધી સુખર માને લાગ કે તે માને લાગ તે માને તે માને લાગ તે સામ તે કોમ તે માને લાગ તે સામ તે માને સામ તે સામ તે માને લાગ તે સામ તે માને લાગ તે સામ તે માને લાગ તે સામ તે માને સામ તે સામ તે સામ તે સામ તે માને લાગ તે સામ તે માને સામ તે સામ તે

Palled Piede of the Comment of the C

પસંદગીના લોકોના હિતમાં સેવા ધોરણોનો સમાવેશ થાય છે. આ આપે છે તે દાવાઓ પાયાવિહોણા પગલા પારદર્શતા અને રોકાણકારોના હિતના રક્ષણ માટે રચાયેલા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. શનિવારે હિંડનબર્ગના અહેવાલમાં એવા આક્ષેપ કરવામાં

સમૂહને ફાયદો પહોંચાડવા માટે છે.

કરવામાં આવ્યા હતાં, તે પછી આ નિવેદનમાં જણાવ્યું હતું નિવેદન આવ્યું છે. આ સંદર્ભમાં આરઈઆઈટી (રિયલ એસ્ટેટ બજાર નિયમનકારે જણાવ્યું હતું ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) રેગ્યુલેશન કે, સેબી રેગ્યુલેશન્સ ૨૦૧૪માં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો હતો.

૨૦૧૪માં રજૂ કરવામાં આવ્યો

અમદાવાદ સ્ટીલક્રાફ્ટ લીમીટેડ

અસાદ્યારણ સામાન્ય સભાની નોટીસ

જાલાદા પાસ્ત્ર ક્ષિતિ કહેલા કિલાકા કહિલા કહિલા કહિલો કહિલો

earc c3 એન્કોર એસેટ રિકન્ટ્રક્શન કંપની પ્રાઇવેટ લીમીટેડ મો માળ, પ્લોટ નં. ૧૩૭, સેક્ટર-૪૪, ગુરગૉવ-૧૨૨૦૦૨, હાં

નિયમ ૮ (૧) કબજા નોટીસ

ોરિયા ૩૦૦ સો.ચાર્ડ, સુપર બિલ્ટ અપ એરિયા, સોહમ આંબલી કં ચટી લીમીટેડ તરીકે જાણીતી સોસાચટીમાં, ગ્રીન પાર્ક બંગ્લોઝ તર્ર જાણાતા રહીમમાં, સીટી ગોહદ સ્ત્રિનમાં શામે, સર્વે ન . 338/લી, ટાર્કિન પ્લાર્કિંગ સ્ટ ફાર્કાનલ પોટાન્સ દૂર, ગામ આંભારી, આંભારી -બોલલ રીક, આંભારી, અલ્લાલાન્સ વ્યુપ્તિમાન પુર્વ- નિક્કેટન . 6, કપ્તી કર્યું કર્યુ કર્યું કર્ય જાણીતી સ્ક્રીમમાં, સીટી ગોલ્ડ 'સનેમાં સામે, સર્વે નં. 338/બી, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. પ

ું એન્કોર એસેટ રિકન્ટ્રક્શન કંપની eare પાઇવેટ લીમીટેડ પાંચો માળ, પાંઢે નં. ૧૩૦, રોક્ટર-૧૪, ગુરુપીવ-૧૨૪૦૦૨, ઉદેશાદા, છોના ૧૨૪-૨૫૨૦૦૧

નિયમ ૮ (૧) કબજા નોટીસ

શસ કરીને દેવાદાર, સહ-દેવાદાર અને ગીરવેદાર અને જાહેર જનતાને આશ્રી મિલકત સાથે કે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાક્ષેના કોઈપણ સોદા એન્કોર એઆરસી સ્ક્રમ રૂા. ૧,૦૫,૫૧,૨૨૮ (– (રૂપિયા એક કરોડ પંત્રોતેર લાખ એકાવન ઉજાર બસો અહવાન પુત્ર) ૩૧.૦૭.૨૦૨૪ મુજબ તેમજ પરત સુકલાશી/વસુલાત, જો કોઈ ક્ષેત્ર તો તે બાદ કર્યો પદ વાસ્તવિક/લૂટકારાની લારીખ સુધી ૭૧.૦૮.૨૦૨૪ શી કરારના દરે શક્ત વ્યાજના સાર્વને આદિ

જોગવાઈઓ પત્યે દેવાદારોનં ધ્યાન દોરવામાં આવે છે

સ્થાવન દિવસનો વિગત પોટ નં. ક, ધામબર કોલોની પૈકી મિલકત લેમકુળ શ્વક 30 સો.મી. ધરાવતી , દકિયલ બાજુ (સ્ત્ર કિફીને, 3,59/)બી મુખ્ય), બાંધકામ એટિયા વધુ સો.મી. આઉન્ક કહોય પર અને ૮૦. સો.મી. પોઢાલા આપ્તા કે સ્કુરા કે સ્ત્રુપાર્થ મુખ્ય પ્રતાસ કે આપ્તા કર્યો મી. આઉન્ક કહોય પર અને ૮૦. સો.મી. પોઢાલા ભાગદસ્થાની એટલ સેવેલે અંગ્લે મુશ્કે સ્ત્રુપાર્થ સ્ત્ર પૂર્વ: અભિતનગર સોસાયટીનો અંદરનો સેડ અને સીટી સર્વે નં. ૩૬૭૨/૪, પશ્ચિમ: ધાયબરની મિલકત, ઉત્તર: શ્રી અમરસિંઘ ધાયબરની મિલકત, દક્ષિણ: શ્રી રાજેન્દ્ર મિલકત એટલે કે સીટી સર્વે નં. ૩૬૭૨/૨/એ

TEMS [CIN: L72900GJ2012PLC070106] રજીસ્ટર્ડ ઓફીસ : રજમો માળ, ગીફ્ટ ટું બિલ્ડીંગ, બ્લોક નં. પદ, રોડ–પ સી, ઝોન–પ, ગિફ્ટ સિટી, ગાંધીનગર –૩૮૨ ૩૫૫, ગુજરાત

+69 (06 F,000000) STRING : ir@drcsvstems com Courtes : www.drcsvstems.com

માંચી નોટીસ આપવામાં આવે છે કે ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ (કંપની) ના સભ્યોની ૧૨મી વાર્ષિક સામાન્ય સલ્

માટે નીગ્રેની પ્રક્રિયા અનસરવા વિનંતી છે.

નાદ ભાવના પ્રાક્ષ્યા અનુતરના પાત્રવા છું. એ) ફિક્કિલ વર્ષ એ દરાવાના સભ્યો માટે : <u>in@draystams.com</u> પર દમોઇલ કરીને આવશ્યક વિગતો તેની કે ફોરિસો નંબર, ત્રેરફોલ્ડરનું નામ ભણાવવા વિનંતી છે અથવા ઇ-કોમ્યુનિકેશન રપ્તુષ્ટ્રેશન ફોર્મ, જે કંપની વેબસાઇટ <u>www.draystams.com</u> પર ઉપલબ્ધ છે, વે ભરી કંપનીને ઇમેઇલ કરવા વિનંતી છે. **બી)** ડીમેટ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો તેમના લાગતા વળગતા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરીને તેમના ઇમેઇલ આઇડ

. જીસ્ટર્ડ ઈ–મેઈલ એડ્રેસો પર લાગુ કાયદાઓ અનુસાર મોકલવામાં આવશે. **ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ વતી,**

eicu · ວາເຮັກິສເວເລ તારીખ : ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪